

તાલુકા પંચાયત નડીઆદ (શિક્ષણ શાખા)												
આવકવેરા ગણતરી પત્રક (નવા સ્વેચ્છ મુજબ) (NEW REGIME)												
નાણાકીય વર્ષ	૨૦૨૫-૨૬						આકારણી વર્ષ			૨૦૨૬-૨૭		
કર્મચારીનું નામ:							પે.સેન્ટર નું નામ					
પિતાનું પૂરું નામ:							જન્મ તારીખ:					
પ્રા. શાળા નું નામ:							શાળા નો પીનકોડ નંબર:					
રહેઠાણ નું પૂરું સરનામું							રહેઠાણ નો પીનકોડ નંબર					
							મોબાઇલ નં.					
ઇન્કમેટેક્સ PAN (કેપિટલ અક્ષરમાં)									આધાર કાર્ડ નં.			
બેન્ક એકાઉન્ટ નંબર							બેંક બ્રાન્ચ					
ઈ.મેલ આઇ. ડી							IFSC CODE					
વર્ષ ૨૦૨૫-૨૬ નો માસવાર પગાર	કુલ પગાર		NDCPS કપાત									
માર્ચ પેઇડ એપ્રિલ ૨૫												
એપ્રિલ પેઇડ મે ૨૫												
મે પેઇડ જૂન ૨૫												
જૂન પેઇડ જુલાઈ ૨૫												
જુલાઈ પેઇડ ઓગસ્ટ ૨૫												
ઓગસ્ટ પેઇડ સપ્ટેમ્બર ૨૫												
સપ્ટેમ્બર પેઇડ ઓક્ટો ૨૫												
ઓક્ટો પેઇડ ઓક્ટો ૨૫												
નવે પેઇડ ડિસે ૨૫												
ડિસે પેઇડ જાન્યુ. ૨૬												
જાન્યુ. પેઇડ ફેબ્રુ. ૨૬												
ફેબ્રુઆરી પેઇડ માર્ચ ૨૬												
મોઘવારી તફાવત												
૦૧/૦૧/૨૫ થી ૩૧/૦૩/૨૫ (૨%)												
૧/૦૪/૨૫ થી ૩૦/૬/૨૫ (૩ %)												
ઉ.પ.ધો. તફાવત બિલ												
અન્ય આવક / પુરવણી બિલ												
NDCPS મા સરકાર શ્રી નો હિસ્સો												
કુલ												
[A] પગારની કુલ આવક												
બાદ												
(૨) સ્ટાન્ડેડ ડિડકશન (તમામને રૂ.75૦૦૦)(US/16)							75000					
[B] વ્યાજ આવક: (૧) બેંક તમામ બચત ખાતાના વ્યાજ (ફરજીયાત લખવું)												
(૨) એન.એસ.સી. વ્યાજ/F.D.નુ વ્યાજ/બેંક રિકરિંગ વ્યાજ												
અન્ય આવક:												
કુલ:												
[C] એકંદરે કુલ આવક:(A+B)												

કુલ ગ્રીસ આવક: [C] મુજબ		
[D] (U/S 80 CCD- 2) મુજબ બાદ મળતી કપાત		
(1) NDCPS મા સરકાર શ્રી નો હિસ્સો		
[E] કરપાત્ર આવક [C] - [D]		
કરપાત્ર આવક: (નજીકના ૧૦ રૂપિયામાં)		
[F] આવક વેરાની રકમ		
કરપાત્ર આવકની ગણતરી		
૧ પ્રથમ રૂ. ૪,૦૦,૦૦૦ સુધી	NIL	
૨. રૂ. ૪,૦૦,૦૦૧ થી ૮,૦૦,૦૦ સુધીની રકમના ૫ %		
૩. રૂ. ૮,૦૦૦૦૧ થી ૧૨,૦૦,૦૦૦ સુધીની રકમના ૧૦ %		
૪. રૂ. ૧૨,૦૦,૦૦૧ થી ૧૬,૦૦૦૦૦ સુધી ની રકમ ના ૧૫ %		
૫ . રૂ. ૧૬,૦૦,૦૦૧ થી ૨૦,૦૦,૦૦૦ સુધી ની રકમ ના ૨૦ %		
૬ રૂ. ૨૦,૦૦,૦૦૧ થી ૨૪,૦૦,૦૦૦ સુધી ની રકમ ના ૨૫ %		
૭ રૂ. ૨૪,૦૦,૦૦૦ થી વધુ રકમ ના ૩૦ %		
ઉપરની ગણતરી મુજબ આવકવેરાની કુલ રકમ [F] મુજબ		
બાદ રિબેટ 87 A (મહત્તમ રૂ. ૬૦,૦૦૦) કરપાત્ર આવક (E) મુજબ ૧૨ લાખ સુધી હોય તો જ ૧૨ લાખથી વધુ આવક હોય તો આ લાભ મળશે નહીં		
બાકી આવકવેરો		
[G] ઉમેરો એજ્યુકેશન સેસ ૩% તથા મેડીકલ સેસ 1% કુલ 4 %		
[H] ભરવાપાત્ર આવકવેરાની રકામ		
[I] કલમ ૮૯ (૧) ઇ મુજબ બાદ જો હોય તો		
[J] કલમ ૮૯ (૧) ઇ મુજબ બાદ કર્યા બાદ રહેતી રકમ		
બાદ: ચાલુ વર્ષમાં કપાત કરેલ /એડવાન્સ ટેક્સ		
[K] બાકી રહેતા આવક વેરાની રકમ		
સ્થળ _____		
તારીખ _____		

માસ	ટેક્સની કપાત
માર્ચ પેઇડ એપ્રિલ રપ	
એપ્રિલ પેઇડ મે રપ	
મે પેઇડ જૂન રપ	
જૂન પેઇડ જુલાઈ રપ	
જુલાઈ પેઇડ ઓગસ્ટ રપ	
ઓગસ્ટ પેઇડ સપ્ટેમ્બર રપ	
સપ્ટેમ્બર પેઇડ ઓક્ટો રપ	
ઓક્ટો પેઇડ ઓક્ટો રપ	
નવે પેઇડ ડિસે રપ	
ડિસે પેઇડ જાન્યુ. 2૬	
ઉપ ધો એડ. ટેક્સ	
અન્ય કપાયેલ ટેક્સ	
કુલ	0
કર્મચારી ની સહી તથા હોદ્દો	
આચાર્યની સહી	